



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તાર૯/૦૭/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૭૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦૩ કેસ કરી, ૮૭ વ્યક્તિઓને ઝડપી, ૮૦૫ લીટર દેશી દારૂ, ૪૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૬ બિયર ટીન અને ૦૨ સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૧૧ કેસ કરી, ૫૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૬,૫૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૭૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૨૭૫/૧૯

ગાયકવાડ હવેલી : રઝીયાબેગમ વા/ઓ ઇકબાલ ખાન (ઉ.વ.૭૦)(રહે.રીયઝહાઉસ બેંક ઓફ બરોડા એ.ટી.એમ. પાસે નગરી બિલ્ડીંગ સામે આસ્ટોડીયા રોડ) એ તા.૨૮/૭/૧૯ નારોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૦૭/૨૦૧૯ ના કલાક ૯/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે રઝીયાબેગમના મોબાઇલ ઉપર કોઇ અજાણ્યા ઇસમે ફોન કરી “ડેબીટ કાર્ડ બંધ છે તે બાબતે ચાલુ કરાવવા સારૂ તમારો કાર્ડ નંબર તથા OTP નંબર આપો” તેમ કહેતા, રઝીયાબેગમ ને શક-વહેમ જતા ડેબીટ કાર્ડ નંબર કે OTP નંબર તથા બેંક ને લગતી કોઇપણ માહિતી આપેલ નહી તેમ છતા તેમના બેંક ખાતામાંથી કુલ રૂપિયા ૨૫,૦૬૨/- ઉપાડી લઇ રઝીયાબેગમ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એન.પરમાર ચલાવે છે.

સાયબર ક્રાઇમ : કિરીટભાઈ પટેલ (રહે. વસ્ત્રાપુર) એ તા.૨૮/૭/૧૯ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૨/૨૦૧૯ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧)આલોક સક્ષેના મો.નં. ૯૯૧૦૯૩૬૪૫૬ (૨) રમણદીપ શર્મા મો.નં. ૮૫૮૬૯૫૭૦૨૫ (૩) જે.પી.પ્રજાપતિ મો.નં.૯૯૧૦૫૨૭૭૫૯ ના ધારક તથા અલગ-અલગ એકાઉન્ટ નંબરોના ધારકોએ ભેગામળી કિરીટભાઈને લાઈફ ઈન્ચોરન્સ પોલીસીના અગાઉ ભરેલ નાણા રીફંડ આપવાનું જણાવી, અગલ-અલગ મોબાઇલ નંબરથી ફોન કરી વિશ્વાસ અને ભરોસો આપી, અલગ-અલગ ચાર્જ પેટે કુલ રૂપિયા ૩૫,૪૨,૭૫૭/- ઓન લાઈન ભરાવડાવી, પોલીસીના નાણા પરત નહી આપી કિરીટભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.સી.સિગરખીયા ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૧૨૭૬/૧૯

શહેરકોટડા : ચીમનલાલ રણછોડભાઈ પઢીયાર (ઉ.વ.૬૩)(રહે.પરીમલ પોઇન્ટ, માણ્ટી પ્લાઝાની પાછળ, બાપાસિતારામ ચોક રોડ, વિજય પાર્કની સામે, કૃષ્ણનગર)એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૭/૨૦૧૯ ના કલાક ૩/૦૦ વાગ્યાના સુમારે નરોડા રોડ વિજયમીલ ગલીમાં રોડ ઉપર ઓટોરીક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન ઓટોરીક્ષાનો ડ્રાઇવર તથા રીક્ષામા બેસેલ બે પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષના આશરના) એ ભેગામળી રિક્ષા ઉભી રાખી, ચીમનલાલના ગળામાંથી સોનાની ચેઇન ખેંચતા, ચીમનલાલે ચેઇન પકડી લેતા, અડધી ચેઇન તોડી ઝુંટવી લઈ, રૂપિયા ૪૦૦/- મુકેલ પાકીટ અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦/- ઝુંટવી લઈ, “અમને બધી વસ્તુ આપી દો” તેમ કહી છરીનો ઘા જમણા હાથની કોણીએ મારી ઇજા કરી, ચીમનલાલની સોનાની વીંટી કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૦,૪૦૦/- મતાની લુંટ કરી નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એસ.પરમાર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૨૭૭/૧૯

ખોખરા : શંકરભાઈ સોમાભાઈ ઠાકોર (ઉ.વ.૮૦)(રહે.બાલકૃષ્ણ સોસાયટી, લક્ષ્મીનારાયણ પાસે, ખોખરા) નાઓ છેલ્લા ચારેક વર્ષથી બીમાર હાલતમા હોઈ તા.૨૮/૦૭/૨૦૧૯ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળે રૂમાલ બાંધેલ અને નીચે પડેલ બેભાન હાલતમાં મળી આવતા, સારવાર અર્થે તેમને એલ.જી.હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડૉ.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ખોખરા પોલીસે અક્સ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.મકવાણા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.